



INDUSTRIES LIMITED
(Formerly known as DOMS INDUSTRIES PVT. LTD.)

Ref. No. DIL/SE/24-25/06

Date: April 16, 2024

To,
The Manager
Corporate Relationship Department
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai - 400 001

The Manager
Listing Department
National Stock Exchange of India Limited
Exchange Plaza, Bandra Kurla Complex,
Bandra (East),
Mumbai - 400 051

BSE Symbol - DOMS
BSE Scrip Code - 544045

NSE Symbol - DOMS

Subject: Intimation of Newspaper Advertisement of Postal Ballot Notice

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements), Regulation, 2015 ('SEBI LODR Regulations'), as amended and with reference to our intimation letter dated April 15, 2024, vide Ref. No. DIL/SE/24-25/05 regarding the Postal Ballot Notice, please find enclosed the copies of the newspaper in which the advertisement with respect to the Postal Ballot Notice was published in 'Financial Express' (English) - All India Edition and in 'Daman Ganga Times' (Gujarati), Vapi Edition.

The above information is available on the website of the Company at www.domsindia.com.

We request you to take the same on record.

Thanking you,
Yours faithfully,

For **DOMS Industries Limited**

Mitesh Padia
Company Secretary and Compliance Officer
Membership No. A58693

Encl.: As Above

Registered Office:

J-19, Opp. Telephone Exchange,
G.I.D.C., Umbergaon- 396171,
Dist. Valsad, Gujarat, India.

Website:

www.domsindia.com

Corporate Office:

Plot No. 117, G.I.D.C., 52, Hector Expansion
Area, Umbergaon- 396171,
Dist. Valsad, Gujarat, India.

Tel: (+91) 7434888445 / 446

E-mail: info@domsindia.com

Mumbai Office:

17th Floor, C-Wing, Kailas Business Park,
Hiranandani Link Road, Vikhroli (W)
Mumbai- 400079, Maharashtra, India.

Tel: (+91) 7069028500 / 600

Email: asst.admin@domsindia.com



Franklin Templeton Mutual Fund
Registered Office: One International Center, Tower 2, 12th and 13th Floor, Senapati Bapat Marg, Elphinstone Road (West), Mumbai 400013

Income Distribution cum capital withdrawal (IDCW) in Franklin India Dynamic Asset Allocation Fund of Funds and Franklin India Debt Hybrid Fund.

The Trustees of Franklin Templeton Mutual Fund have decided to distribute the following Income Distribution cum capital withdrawal (IDCW):

Table with 4 columns: Name of the Schemes / Plans / Options, Face Value per Unit (₹), Amount of IDCW per Unit* (₹), NAV per Unit as on April 12, 2024 (₹)

The Record Date for the same will be April 19, 2024 (Friday). If in case the Record Date falls on a non-Business Day, the immediately following Business Day shall be the Record Date.


Please note that the IDCW payout shall be subject to the availability of distributable surplus and if the available distributable surplus as on the record date is lower than the aforementioned IDCW rate, then the available distributable surplus shall be paid out.

Pursuant to payment of IDCW, the NAV of the scheme would fall to the extent of payout and statutory levy (if applicable).

For Franklin Templeton Asset Management (India) Pvt. Ltd. (Investment Manager of Franklin Templeton Mutual Fund)

Sd/-
Authorized Signatory
Date: April 15, 2024

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.



PGIM India Asset Management Private Limited
4th Floor, C wing, Laxmi Towers, Bandra Kurla Complex, Bandra (East), Mumbai - 400 051.
Tel.: +91 22 6159 3000. Fax: +91 22 6159 3100
CIN: U74900MH2008FTC187029 Toll Free No.: 1800 266 7446
Website: www.pgimindiamf.com

NOTICE

Notice is hereby given that PGIM India Trustees Private Limited, Trustee to PGIM India Mutual Fund, has approved declaration of Income Distribution cum Capital Withdrawal (IDCW) under the following schemes of PGIM India Mutual Fund with April 19, 2024 as the record date: -

Table with 5 columns: Scheme Names, Plans / Options, Quantum of IDCW per Unit (Gross of Statutory Levy, if any)* (₹), Face Value (₹ Per Unit), NAV of IDCW Option as on April 12, 2024 (₹ per unit)#

*Pursuant to payment of IDCW, the NAV of the above-mentioned option of the Schemes would fall to the extent of payout and statutory levy, if any.

IDCW will be paid to those unit holders whose names appear in the records of the Registrar as at the close of business on the record date. For units in dematerialized form, all unit holders whose names appear in the beneficiary position file downloaded from the depositories as on the record date will be entitled to receive the IDCW.

*The IDCW distribution will be subject to the availability of distributable surplus under the schemes and may be lower to the extent of distributable surplus available on the Record Date.

For PGIM India Asset Management Private Limited (Investment Manager for PGIM India Mutual Fund)

Sd/-
Authorized Signatory
Date: April 15, 2024

Unit holders are requested to update their PAN, KYC, email address, mobile number, nominee details with AMC and are also advised to link their PAN with Aadhar Number. Further, Unit holders can view the Investor Charter available on website of the Mutual Fund as well as check for any unclaimed redemptions or Income Distribution cum Capital Withdrawal ('IDCW') payments.

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

RAJASTHAN GASES LIMITED

Corporate Identification Number: L24111MH1993PLC272204
Registered Office: 103, Roha Orion, 16th Street Near 33rd Road TPS III, Bandra, Mumbai, West Mumbai - 400050, Maharashtra, India.
Tel: 022-26465178. Website: www.rajasthangesltd.com. Email ID: info@rajasthangesltd.com

Recommendations of the Committee of Independent Directors of Rajasthan Gases Limited, the Target Company, in relation to the Open Offer made by Mr. Ravi Omprakash Agrawal, the Acquirer along with Mrs Ravi Omprakash Agrawal HUF (PAC 1), Ms. Anita Ravi Agrawal (PAC 2), Mr. Niraj Omprakash Agrawal (PAC 3), Ms. Sanchit Niraj Agrawal (PAC 4), Mr. Dhiraj Omprakash Agrawal (PAC 5), Mr. Rupali Dhiraj Agrawal (PAC 6), and Mr. Suraj Omprakash Agrawal (PAC 7), collectively referred to as the Persons Acting in Concert with the Acquirer, for acquisition of up to 2,15,47,188 (Two Crores Fifteen Lakhs Forty-Seven Thousand One Hundred Eighty-Eight) fully paid-up equity shares of face value of ₹3.00/- (Rupees Three Only) each, representing 25.00% (Twenty-Five Percent) of the Expanded Voting Share Capital of Rajasthan Gases Limited, at an Offer Price of ₹9.25/- (Nine Rupees and Twenty-Five Paise Only) per Offer Share, payable in cash, to the Public Shareholders of the Target Company under Regulations 26 (7) of Securities and Exchange Board of India (Substantial Acquisition of Shares and Takeovers) Regulations, 2011 and subsequent amendments thereto.

Table with 3 columns: Sr. No., Name, Designation. Details of the Offer, Names of the Acquirer/PACs, Manager to the Offer, Members of the Committee of Independent Directors (IDC Members), etc.

ICD Member's relationship with the Target Company (Director, Equity shares owned, any other contract/relationship), if any. Trading in the Equity shares/other securities of the Target Company by IDC Members. Recommendation on the Open offer, as to whether the offer, is or is not, fair, and reasonable. Summary of reasons for the recommendation.

Based on the review of the aforesaid Offer Documents, the IDC Members are of the view that the Offer Price is in line with the parameters prescribed by SEBI in the SEBI (SAST) Regulations. The Equity Shares of the Target Company are listed and traded on BSE and are infrequently traded within the definition of 'Frequently traded shares' under clause (j) of sub-regulation (1) of Regulation 2 of the SEBI (SAST) Regulations on BSE Limited.

Table with 3 columns: Sr. No., Particulars, Price (In ₹ per Equity share). Details of the offer price and other terms.

In view of the parameters considered and presented in the table above, in the opinion of Acquirers and Manager to the offer, the offer price is ₹9.25/- (Nine Rupees and Twenty-Five Paise Only) in terms of Regulation 8(2) of the SEBI (SAST) Regulations.

Disclosure of Voting Pattern. Details of Independent Advisors, if any. Any other matter to be highlighted.

For and on behalf of the Committee of Independent Directors Rajasthan Gases Limited. Chairperson of the Committee Ms. Gauri Bhagat, Independent Director (DIN: 06950001)

"IMPORTANT"

Whist care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.



Registered Office: Flat No.103, Ground Floor, R Square, Pandurangapuram, Visakhapatnam - 530003, A.P. India
Corporate Office: G-2, Concorda Apartments, 6-3-658, Somajiguda, Hyderabad - 500082, T.S. India. Tel: 040-23310260/261, e-mail: investors@avantifeeds.com. Website: www.avantifeeds.com

NOTICE is hereby given that the following Share Certificates of face value of ₹1/- each of the Company as per details given hereunder have been reported as LOST / MISPLACED. The shareholders are requested to apply for duplicate share certificate if NO OBJECTION is received within 15 days from the date of publication of this Notice. We shall consider issue of Duplicate Share Certificates thereafter.

Table with 5 columns: Folio No., Name, No. of Equity Shares of ₹1/- each, Certificate No.(s), Distinctive No.(s)

Place: Hyderabad, Date: 15.04.2024. For Avanti Feeds Limited, Sd/- C. Ramachandrarao, JMD, CS & CFO

PURAVANKARA PURAVANKARA LIMITED

(CIN: L45200KA1986PLC051571)
Registered Office: No. 130/1, Ulsoor Road, Bangalore - 560 042
Tel: 080 2559 9000/4343999
Email: info@puravankara.com Website: www.puravankara.com

Postal Ballot Notice

Members are hereby informed that pursuant to the provisions of Sections 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ('Act') read together with Rule 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ('Rules'), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations'), Secretarial Standard issued by the Institute of Company Secretaries of India ('SS-2') on General Meetings, each as amended, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ('MCA') for holding general meetings/conducting postal ballot process through e-voting vide General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022, 11/2022 dated December 28, 2022 and 09/2023 dated September 25, 2023 (collectively the 'MCA Circulars') and any other applicable laws, rules, circulars, notifications and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), the approval of members of Puravankara Limited (the "Company") is sought for the following special resolution through Postal Ballot only by the way of remote e-voting process (e-voting):

Table with 2 columns: Sl. No., Description of Special Resolution. 1. To approve alteration of the 'Objects' Clause of the Memorandum of Association of the Company

Pursuant to the provisions of the Act and MCA Circulars, the Company has completed the dispatch of electronic copies of the Postal Ballot Notice along with the explanatory statement on Monday, 15th April 2024, through electronic mode to those Members whose email addresses are registered with the Company/depository participant(s) as on 12th April 2024 ("Cut-off Date").

The said Notice is also available on the website of the Company: www.puravankara.com/investors, the relevant section of the website of BSE Limited ("BSE"): www.bseindia.com and National Stock Exchange of India Limited ("NSE"): www.nseindia.com and on the website of National Securities Depository Limited ("NSDL"): www.evoting.nsdl.com. Members who do not receive the Postal Ballot Notice may download it from the above-mentioned websites.

In accordance with the provisions of the MCA Circulars, Members can vote only through e-voting process. The voting rights of the Members shall be reckoned on the basis of the equity shares of the Company held by them as on the Cut-off Date. Any person who is not a shareholder of the Company as on the Cut-off Date shall treat the Postal Ballot Notice for information purposes only. The detailed procedure and instructions for e-voting are enumerated in the Postal Ballot Notice.

The Company has engaged the services of National Securities Depository Limited ("NSDL") for the purpose of providing e-voting facility to all its Members. The e-voting facility will be available during the following period:

Table with 2 columns: Commencement of e-Voting period, Conclusion of e-Voting period, Cut-off date for eligibility to vote

The e-voting facility will be disabled by NSDL immediately after 5.00 p.m. (IST) on Wednesday, 15th May 2024. The Board has appointed Mr. Nagendra D. Rao, Practicing Company Secretary (Membership No. FCS 5553, CP No. 7731) as the Scrutinizer for conducting the e-voting process in a fair and transparent manner.

The Scrutinizer will submit his report to the Chairman or Company Secretary of the Company, or any other person authorised by the Chairman, and the result will be announced within two working days from the conclusion of the e-voting period i.e. on or before 5:00 p.m. (IST) on Friday, 17th May 2024. The declared Results along with Scrutinizer's Report will be available forthwith on the Company's website at www.puravankara.com/investors and on NSDL's website at www.evoting.nsdl.com and will also be communicated to the BSE and NSE.

In case of any queries/ grievances concerning with voting by electronic means, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-Voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 /1800 224 430 or send a request at evoting@nsdl.co.in.

In case of any queries related to Postal Ballot notice or in case any member whose name appears in the Register of Members/ List of Beneficial Owners as on cut-off date, has not received the Postal Ballot Notice, he/she may write to investors@puravankara.com.

By Order of the Board of Directors For Puravankara Limited. Sd/- Sudip Chatterjee, Company Secretary, Membership No.: F11373

Place: Bengaluru, Date: 16 April 2024



The Tata Power Company Limited, Smart Center of Procurement Excellence, 2nd Floor, Sahar Receiving Station, Near Hotel Leela, Sahar Airport Road Andheri (E), Mumbai 400 059, Maharashtra, India (Board Line: 022-47173917) CIN: L28920MH1919PLC090567

NOTICE INVITING TENDER (NIT)

The Tata Power Company Limited invites tenders from eligible vendors for the following package (Two Part Bidding) in Transmission division, Mumbai. Outline Agreement of 03 Years providing support services for maintenance activity in Trombay Station-A and Chembur Receiving Station in Mumbai. (Package Reference: CC25NP002).

For downloading the Tender documents (including procedure for participation in tender) for above tender, please visit Tender section on website https://www.tatapower.com. Last day for paying the tender fees and submission of authorization letter is 1500 hrs of 26th April 2024. Also, all future corrigendum's (if any), to the above tenders will be informed on Tender section on website https://www.tatapower.com only.

PUBLIC NOTICE

Notice is hereby given that the SHARE CERTIFICATE NO. 101143 for 500SHARES bearing DISTINCTIVE NO(S). 65645586 - 65646085, FOLIO NO. TSE0013470 standing in the name(s) of MRS. DEEPAI H GUPTA (AFTER MARRIAGE NAME MRS. DEEPAI G GUPTA) & MR. HARISH C GUPTA in the books of M/s. THERMAX LIMITED, has / have been lost / misplaced / destroyed and the advertiser has / have applied to the company for issue of duplicate share certificate(s) in lieu thereof. Any person (s) who has / have claim(s) on the said shares should lodge such claim(s) with the company's registrars and transfer agents viz KFCIN TECHNOLOGIES PRIVATE LIMITED, SELENIUM TOWER B, PLOT NO 31 - 32 GACHIBOWLI, FINANCIAL DISTRICT, NANAKRAMGUDA, HYDERABAD - 500 032 within 15 DAYS from the date of this notice failing which the company will proceed to issue duplicate share certificate(s) in respect of the said Share.

Date: - 16/04/2024. Name of the Shareholder/s :- MRS. DEEPAI H GUPTA (AFTER MARRIAGE NAME MRS. DEEPAI G GUPTA & MR. HARISH C GUPTA. Place: - MUMBAI



Regd. Off. J-19, G.I.D.C. Opp. Telephone Exchange, Umbergaon - 396171, Gujarat, India. Tel. No.: 743488445 | Email: info@domsindia.com | Website: www.domsindia.com

POSTAL BALLOT NOTICE

NOTICE is hereby given to the Shareholders of DOMS Industries Limited ('the Company'), pursuant to the provisions of Sections 108 and 110 and other applicable provisions of The Companies Act, 2013 ('the Act') read with The Companies (Management and Administration) Rules, 2014, and General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022, 11/2022 dated December 28, 2022 and 09/2023 dated September 25, 2023, issued by the Ministry of Corporate Affairs, Government of India ('MCA Circulars'), the Secretarial Standard - 2 on General Meetings issued by the Institute of Company Secretaries of India ('SS-2') and any other applicable laws, rules, circulars, notifications and regulations (including any statutory modification(s) and/or re-enactment(s) thereof for the time being in force), that the resolutions as set out below be passed by the Shareholders of the Company through Postal Ballot by way of remote electronic voting ('remote e-voting') for the following Special Resolutions:

Table with 2 columns: Sr. No., Particulars. 1. Ratification of DOMS Industries Limited Employee Stock Option Plan 2023 ('ESOP 2023')/the Plan'. 2. Ratification of Grant of Options to the Employees of the Subsidiary Companies from Employee Stock Option Plan (ESOP 2023)/the Plan of the Company. 3. Approval for providing Loan to Subsidiary Companies (i) Pioneer Stationery Private Limited (ii) Metro Wood Private Limited (iii) Skids Industries Private Limited (SKIDO). 4. Ratification of Promoter's listing in accordance with Regulation 31B of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended ('SEBI LODR Regulations').

In compliance with the MCA Circulars, the Company has completed the dispatch of the Postal Ballot Notice, by electronic means only, on Monday, April 15, 2024, to those Shareholders of the Company whose names appeared in the Register of Members / List of Beneficial Owners as maintained by the Company's Depositories, respectively, as at close of business hours on Friday, April 12, 2024 ('the Cut-off Date') and whose e-mail addresses are registered with the Company / Depositories. The Postal Ballot Notice is available on the Company's website at www.domsindia.com and website of the Stock Exchanges on which Equity Shares of the Company are listed i.e. BSE Limited ('BSE') at www.bseindia.com and National Stock Exchange of India Limited ('NSE') at www.nseindia.com and on the website of National Securities Depository Limited ('NSDL') at www.evoting.nsdl.com.

Shareholders whose names appeared on the Register of Members / List of Beneficial Owners as on the Cut-off date are entitled to vote on the Resolutions as set forth in the Postal Ballot Notice. The voting rights of the members shall be reckoned in proportion to the paid-up Equity Shares held by them as on the Cut-off date. A person who is not a Shareholder as on the Cut-off date shall treat the Postal Ballot Notice for information purpose only.

In compliance with MCA circulars, the Company has provided only the remote e-voting facility to its Shareholders, to enable them to cast their votes electronically instead of submitting the physical Postal Ballot form. The communication of the assent or dissent of the Shareholders would take place only through the remote e-voting system. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating remote e-voting to enable the Shareholders to cast their votes electronically only. The detailed procedure and instructions for remote e-voting are enumerated in the Postal Ballot Notice. Remote e-voting shall commence at 09:00 a.m. (I.S.T.) on Thursday, April 18, 2024 and shall conclude at 05:00 p.m. (I.S.T.) on Friday, May 17, 2024. The remote e-voting facility will be disabled for voting by NSDL upon expiry of the aforesaid voting period.

The Board has appointed CS Shravyansh Jais (FCS 8519) of M/s. Shreyans Jain & Co., Company Secretaries, Mumbai as the Scrutinizer for conducting the Postal Ballot / remote e-voting process through electronic means in a fair and transparent manner.

The result of the Postal Ballot will be announced within two working days from the last date of remote e-voting and also be updated on the website of the Company, website of NSDL and will also be intimated to BSE and NSE.

In case of any queries / grievances connected with voting by electronic means, you may contact M/s. Palavi Mhatre, NSDL at evoting@nsdl.com or at telephone number 022-4886 7000. You may also refer to the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-Voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com. In case of any queries related to Postal Ballot Notice or in case any Shareholders whose name appears in the Register of Members / List of Beneficial Owners as on the cut-off date, has not received the Postal Ballot Notice, he / she may write to info@domsindia.com. For DOMS Industries Limited Sd/- Mitesh Padia, Company Secretary and Compliance Officer

